



PBU-1601340102010200 Seat No. _____

M. Lib. I. Sc. (Sem. I) (CBCS) (W.E.F. 2016)
Examination

November / December - 2018

Library Automation & Networking

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- | | | |
|---|--|----|
| 1 | કોઈ એકનો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો :
(૧) ગ્રંથાલય યાંત્રિકીકરણની યોજના સમજાવો.
અથવા
(૨) ગ્રંથાલય યાંત્રિકીકરણની આવશ્યકતા અને મહત્વ સમજાવો. | ૧૪ |
| 2 | કોઈ એકનો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો :
(૧) ગ્રંથાલય નેટવર્કનાં કાર્યો અને સેવાઓ વર્ણવો.
અથવા
(૨) નેટવર્કના પ્રકારો યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. | ૧૪ |
| 3 | કોઈ એકનો આશરે ૧૦૦૦ શબ્દોમાં ઉત્તર આપો :
(૧) ગ્રંથાલયના અંતરિક કાર્યોના યાંત્રિકીકરણ ઉપર ટૂંકનોંધ લખો.
અથવા
(૨) ગ્રંથાલય સોફ્ટવેર સોલ ઉપર નોંધ લખો. | ૧૪ |
| 4 | ટૂંકનોંધ લખો : (કોઈ બે)
(૧) વાયરલેસ નેટવર્ક એટલે શું ? ઉદાહરણ આપો.
(૨) ઈફ્લીબનેટનાં કાર્યો ટૂંકમાં સમજાવો.
(૩) નેટવર્ક ટોપોલોજીના લાભ-ગેરલાભની ચર્ચા કરો.
(૪) એ.આઈ. એટલે શું ? ગ્રંથાલય સંદર્ભે સમજાવો. | ૧૪ |
| 5 | નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે પંક્તિઓમાં આપો :
(૧) આર એફ આઈ ડીના ઉપયોગો સમજાવો.
(૨) બારકોડ એટલે શું ? તેના પ્રકારોનાં નામ આપો.
(૩) મેટા સર્ચ એન્જિન એટલે શું ? તેના ઉપયોગો સમજાવો.
(૪) કોઈ ચાર ગ્રંથાલય નેટવર્કનાં નામ આપો.
(૫) આપ લે મોઝ્યુલના કાર્યોનાં નામ આપો.
(૬) વેબ સંસાધનો એટલે શું ?
(૭) ઈન્ટરનેટ સુરક્ષા એટલે શું ? | ૧૪ |

ENGLISH VERSION

- 1** Attempt any **one** in 1000 words : **14**
(1) Explain a plan for library automation.
OR
(2) Explain the need and importance of library automation.
- 2** Attempt any **one** in 1000 words : **14**
(1) Describe the functions and services of library network.
OR
(2) Explain the types of network with appropriate illustrations.
- 3** Attempt any **one** in 1000 words : **14**
(1) Write a brief note on automation of library housekeeping jobs.
OR
(2) Write a note on library software SOUL.
- 4** Attempt any **two** short notes : **14**
(1) What is meant by wireless network ? Give example.
(2) Briefly explain functions of INFLIBNET.
(3) Discuss merits and demerits of network topology.
(4) What is meant by A. I.? Explain with reference to the library.
- 5** Attempt following questions in one or two lines : **14**
(1) Explain the uses of RFID.
(2) What is bar code? Name its types.
(3) What is Meta search engine ? Explain its use.
(4) Name any four library networks.
(5) Name functions of circulation module.
(6) What are Web resources ?
(7) What is meant by Internet security ?
-